

# PARLE MAHOTSAV

Organiser - **ADV. PARAG ALAVANI**, MLA, President - Vile Parle Cultural Centre  
2, Amber Palace, Chittaranjan Road, Vile Parle (East), Mumbai 400 057.  
Tel.: 26136513, 26177125 • Website : [www.parlemahotsav.com](http://www.parlemahotsav.com)



## પાર્લે મહોત્સવનું 18મા વર્ષમાં પદાર્પણ: સેફ ડ્રાઈવિંગ સ્પર્ધાનો પણ આ વખતે સમાવેશ કરાશે

મુંબઈ: શહેરના લોકપ્રિયમાંથી એક પાર્લે મહોત્સવ આ વખતે 18મા વર્ષમાં પદાર્પણ કરતો હોઈ આ વખતે સેફ ડ્રાઈવિંગ સ્પર્ધાનો પણ સમાવેશ કરાશે. મહોત્સવે 18મા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને ડ્રાઈવિંગ લાઈસન્સ પણ 18મા વર્ષે મળતું હોવાથી આ વખતે સૌને માટે સુરક્ષિતતાની જાણકારી નિર્માણ કરવા આ સ્પર્ધાનું આયોજન નિર્ધારિત છે, એમ મુખ્ય આયોજક વિધાનસભ્ય એડ. પરાગ અળવણીએ જણાવ્યું હતું. પાર્લેના રહેવાસી અને સિંગાપોરથી પોતાની આઈટી કંપની ઝેન્સંગ ચલાવતા અમોદ દીક્ષિતે બનાવેલા એપનો ઉપયોગ કરીને 50થી વધુ માપદંડો પર વાહન ચલાવવાનું પ્રશિક્ષણ કરી શકાય છે. આ એપનો ઉપયોગ કરીને સેફ ડ્રાઈવિંગ સ્પર્ધા લેવામાં આવશે.

આ મહોત્સવ 22મીથી 30મી ડિસેમ્બર સુધી ચાલવાનો હોઈ 31 સ્પર્ધા રખાઈ છે. સાંસ્કૃતિક વિભાગમાં નૃત્ય, ગાયન, સમૂહ નૃત્ય, જોડી નૃત્ય, લઘુ ફિલ્મ, કળા વિભાગમાં ચિત્રકળા, રંગોળી, હસ્તાક્ષર સ્પર્ધા, ઈન્ડોર સ્પોર્ટ્સમાં ચેસ, કેરમ, રાઈફલ શૂટિંગ, જ્યારે આઉટડોરમાં ખોખો, વોલીબોલ, ફૂટબોલ, ક્રિકેટ, બોક્સ ક્રિકેટ, બોડી બિલ્ડિંગ, 50 મીટર દોડ, સ્લો સાઈકલિંગ, ગોળાફેંક, કબડ્ડી, મલ્લખાંબ, યોગા, જ્યારે વિશેષતાપૂર્ણ વિભાગમાં જ્યેષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે સ્પર્ધા અને મેરેથોન અને સેફ ડ્રાઈવિંગનો સમાવેશ રહેશે. મહોત્સવ માટે તડામાર તૈયારી ચાલી રહી છે. વિવિધ સ્તરના કાર્યકરોને અલગ અલગ કામો સોંપવામાં આવ્યાં છે. આયોજન સમિતિના અધ્યક્ષ ગુરચરણજિત સિંગ સંઘુ, ઉપાધ્યક્ષ પ્રવીર કપૂર, વિલાસ કરમળકર, મહામંત્રી મિલિંદ શિંદે, સચિવ સંદીપ ચઘ્લાણ છે. સંચાલન માટે વ્યવસ્થાપન સમિતિમાં અધ્યક્ષ શ્રીકૃષ્ણ આંબેકર, ઉપાધ્યક્ષ રાજેશ મહેતા, એન સુરેશન, જ્યારે મહામંત્રી વિનીત ગોરે અને સચિવ ડો. પ્રસાદ સામંત રહેશે. પાર્લાના પાંચેય નગરસેવકો- સેવિકાઓ જ્યોતિ અળવણી, સુનિતા મહેતા, અનિશ મકવાની, અભિજિત સામંત અને મુરજી પટેલ સહ આયોજક રહેશે. 7 ગ્રુપમાં 32 સ્પર્ધામાં દરેક માટે એક પ્રમુખ અને અન્ય મહત્ત્વપૂર્ણ ખાતા માટે પ્રમુખ નીમવામાં આવ્યા છે, એમ એડ. અળવણીએ જણાવ્યું હતું.

આ વખતે પણ મહોત્સવનું આયોજન સાહ્યે કોલેજના સહયોગથી અને લાયન્સ ક્લબ ઓફ બોમ્બે વિલિંગ્ટનના સહયોગથી સ્પર્ધાનું આયોજન કરાયું છે. ઈચ્છુકોને ભાજપ કાર્યાલય, ચિત્તરંજન રોડ, પાર્લા (વેસ્ટ), મુંબઈ-400 057 ખાતે સંપર્ક સાધવા માટે અથવા વેબસાઈટ [www.parlemahotsav.com](http://www.parlemahotsav.com) અથવા 022- 26177125, 26136513 પર સંપર્ક કરવા માટે તેમણે અનુરોધ કર્યો છે.

# PARLE MAHOTSAV